www.financialexpress.com

| FRIDAY | SEPTEMBER 4 | 2015

Govt plans to invest **₹8.5** L cr in railways

New Delhi, Sept 3: Sharpening focus on infrastructure development to boost growth, government will invest ₹8.5 lakh crore in Indian Railwaystochangethefaceof the sector, minister of state for finance Jayant Sinha said on Thursday.

He also appealed to the opposition parties to help pass the GST bill that will

usher in a new indirect taxes regime in the country, boosting business activity. Speaking at the annual convention of Automotive **Component Manufacturers** Association, Sinha said "Afteradecade of chronic under investment in Indian Rail-

ways we have decided we will invest ₹8.5 lakh crore in Indianrailwaysalone". PTI

THE STATE TRADING CORPORATION OF INDIA LIMITED (A GOVT. OF INDIA ENTERPRISE) Jawahar Vyapar Bhawan, 1 Tolstoy Marg, New Delhi - 110001 Tel: 011-23313177, Fax: 011-23701123. E-mail: co@stc.gov.in EQI NOTICE No. STC/PULSES-IMPORT/EQI/2015-16/01 Dated 03.09.2015 STC invites Expression of Interest (EOI) from Millers & Traders for their import requirement of various varieties of Pulses. Gram & Lentils. For details visit www.stc.gov.in, www.tenders.gov.in and www.eprocure.gov.in. Last date for submission of EOI

DCW Limited

for enrolment with STC is 20.10.2015.

Registered office: Dhrangadhra - 363 315, Gujarat State DCW Head Office: Nirmal, 3rd Floor, Nariman Point, Mumbai 400 021 Tel: 22871914, 22871916 • Fax: 22 2202 8838 Email: ho@dcwltd.com • Website: www.dcwltd.com CIN No. L24110GJ1939PLC000748

NOTICE

The Shareholders of DCW Limited are hereby informed that the result of the Remote E-voting and voting by poll at the Annual General Meeting held on 27th August, 2015 at Registered Office of the Company (at Guest House No. at Dhrangadhra – 363 315 at 10.00 A.M. was declared by the Chairman of the Meeting on 31st August, 2015 on the basis of Report dated 29th August,2015 submitted by Dr. S.K.Jain Proprietor of S.K.Jain & Co. Practicing Company Secretary (FCS 1473 and COP 3076) who was appointed as Scrutinizer to conduct voting through remote E-voting and by Poll at Annual General Meeting in a fair and transparent manner.

All the following Ordinary/Special Resolutions as set out in the Notice of Annual General Meeting dated 28th July, 2015 have been passed with requisite majority.

Vedanta urges Odisha to der to make its Kalahandisecure bauxite for refin- based refinery survive ery survival: Vedanta has against all odds in the urged the Odisha governinternational aluminium menttosecurebauxiteinor- market. PTI

SUZLON ENERGY LIMITED [CIN: L40100GJ1995PLC025447]

Regd. Office: "Suzlon", 5, Shrimali Society, Near Shri Krishna Complex, Navrangpura, Ahmedabad-380009; Tel.: +91.79.6604 5000; Fax: +91.79.2656 5540;

Website: www.suzlon.com; email id: investors@suzlon.com

NOTICE OF TWENTIETH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Twentieth Annual General Meeting (the "AGM") of Suzion Energy Limited (the "Company") will be held on Monday, the 28" day of September 2015 at 11.00 a.m. at J.B. Auditorium, AMA Complex, ATIRA, Dr. Vikram Sarabhai Marg, Ahmedabad-380015 to transact the business, as set out in the Notice of the AGM dated 31" July 2015 (the "AGM Notice"). The Company has on 2" September 2015 completed the dispatch of the physical copies of the AGM Notice along with attendance slip and Annual Report containing Audited Financial Statements for the year ended 31" March 2015 on standalone and consolidated basis and the Reports of the Auditors and Directors (together with annexures thereto) to the shareholders who have not registered their e-mail addresses and sent the same electronically to those shareholders who have registered their e-mail addresses. Please note that as a valued member of the Company, you are entitled to request and receive the same in physical form free of cost. Further, the documents served through email are available on the Company's website www.suzlon.com and are also available for inspection at the Company's Registered Office and Corporate Office between 2.00 p.m. and 5.00 p.m. on all working days (except Saturdays, Sundays and Holidays) till the date of the AGM.

A member entitled to attend and vote at the meeting is entitled to appoint a proxy to attend and vote instead of himself and a proxy need not be a member of the Company. The instrument appointing proxy (in prescribed form), in order to be effective, must be deposited at the Company's Registered Office not less than 48 (Forty Eight) hours before commencement of the AGM.

NOTICE is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and Rules made thereunder read with Clause 16 of the Listing Agreement with the Stock Exchanges that the Register of Members and Share Transfer Books of Suzion Energy Limited shall remain closed from Wednesday, 23" September 2015 to Monday, 28th September 2015 (both days inclusive) for the purpose of the AGM.

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder and Clause 35B of the Listing Agreement with the Stock Exchanges, the Company has availed the services of Karvy Computershare Private Limited ("Karvy") for providing facility of electronic voting system from a place other than the venue of the AGM ("remote e-voting") to the shareholders of the Company. The following information is being provided to the shareholders in respect of remote e-voting:

- The shareholders may cast their votes on all resolutions set out in the 1. AGM Notice using remote e-voting.
- The e-voting rights of the shareholders / beneficiary owners shall be 2. reckoned on the equity shares held by them as on 22rd September 2015, being the Cut-off date for the purpose. The shareholders of the Company holding shares either in dematerialised or in physical form, as on the Cutoff date, only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM.
- The e-voting period commences at 9.00 a.m. on 25th September 2015 and ands on 5.00 p.m. on 27th September 2015, after which voting shall not be

allowed and the e-voting module shall be disabled by Karvy for voting



DGM - I/C MM, Western Onshore Basin, ONGC, Vadodara invites e-bids as per details given below in two bid system through its e-procurement site: Tender No.: B21MC15005 Description: Procurement of Explosives and Detonators Tender Fee: ₹ 500/- Tender Sale Period: 04.09.2015, 1000 Hrs. to 24.09.2015, 1400 Hrs. Closing Date & Time for Receipt of Tender: 24.09.2015 at 1400 Hrs. Opening Date & Time of Tender (Unpriced bid): 24.09.2015 at 1500 Hrs.

THE FINANCIAL EXPRESS

NATION

For further details logon to: https://etender.ongc.co.in

McNally Bharat Engineering Company Limited

Corporate Identity Number (CIN): L45202WB1961PLC025181 Regd. Office : 4, Mangoe Lane, Kolkata - 700001, West Bengal, India Tel: +9133-2213 8901, Fax No: +9133 66282277, E-mail: mbecal@mbecl.co.in Website: http://www.mcnallybharat.com

Corrigendum to the Notice of Annual General Meeting published on September 2, 2015

This has reference to the Notice published on September 2, 2015 convening the Annual General Meeting of the Company

In this regard it is being notified that the period of closure of the Register of Members and Share Transfer Books of the Company should be read as September 21 to September 27, 2015 (both days inclusive) for the purpose of the Annual General Meeting.

All the other information stated in the Notice dated September 2, 2015 will remain unchanged and will be read with this corrigendum.

For McNally Bharat Engineering Co. Ltd.

PRABIR GHOSH WHOLE TIME DIRECTOR & GROUP CFO

RAJ RAYON INDUSTRIES LIMITED

Regd. Off.: Survey No. 177/1/3, Village - Surangi, Dist -Silvassa, Dadra & Nagar Haveli (U.T.) - 396 230 CIN: L17120DN1993PLC000368

NOTICE

ANNUAL GENERAL MEETING: NOTICE is hereby given that the 22"d Annual General Meeting of the Company will be held on Wednesday, 30th September, 2015 at 10.00 a.m. at Survey No. 177/1/3, Village – Surangi, Dist – Silvassa, Dadra & Nagar Haveli (U.T.) – 396 230 to transact the ordinary and special businesses mentioned in the Notice which is being posted to the Members.

BOOK CLOSURE: NOTICE is hereby given under Section 91 of th Companies Act, 2013 (erstwhile Section 154 of Companies Act, 1956) THAT the Register of Members and the Register of Share Transfers will be closed from the 23rd September, 2015 to 30" September, 2015(both days inclusive) for the purpose of Annual General Meeting of the Company. PURSUANT TO SECTION 108 OF THE COMPANIES ACT, 2013:

Notice is hereby given of the members of the Company pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, as under:-

1. The voting in respect of the business to be transacted at the 22nd Annual General Meeting of the Members of the Company to be held on 30" September, 2015, as required under Rule 20 of the aforesaid Rules, will be carried out electronically. The Company has made arrangements with Central Depository Services (India) Limited (CDSL) to facilitate remote e-voting.

The Communication relating to remote e-voting inter alia containing

Jullundur Motor Agency (Delhi) Limited CIN: L35999HR1998PLC033943 Regd. Off.: 458-1/16, Sohna Road, Opp. New Court, Gurgaon-122 001, Haryana, India Email ID: jmaadmincs@jmaindia.com; Website: www.jmaindia.com Ph.: 0124-3019210, 211 Fax: 0124-4233868

NOTICE OF THE 66th ANNUAL GENERAL MEETING **BOOK CLOSURE AND E-VOTING INFORMATION**

NOTICE IS HEREBY GIVEN THAT the Sixty Sixth (66th) Annual General Meeting ("AGM") of the members of Jullundur Motor Agency (Delhi) Limited will be held on Monday, 28th day of September, 2015 at 9:30 A.M. at its Registered office situated at 458-1/16, Sohna Road Opposite New Court, Gurgaon, Haryana - 122 001. 66th Annual Report containing Notice of AGM, Financial Statements and reports of Auditors' and Directors' thereon, Proxy Form and Attendance Slip, have been dispatched to members to their registered email addresses with Company/Depository Participants and by registered book post to the members who have not registered their email addresses with the Company, on 3rd September, 2015. Route Map and prominent land mark have also given in Annual Report for easy location of venue of AGM.

Pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and rules made thereunder and clause 16 of Listing Agreement with Stock Exchange, the Register of Members and the Share Transfer books of the Company will remain closed from Tuesday, 22nd day of September 2015 till Monday, 28th day of September, 2015 (both days inclusive) for the said AGM.

Pursuant to the provisions Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Company is pleased to provide remote e-voting facility to its members enabling them to cast their vote electronically for all the resolutions/businesses as set out in the Notice of AGM.

The Company has availed the e-voting services as provided by Central Depository Services (India) Limited ("CDSL"). Shri Vijay K. Singhal, Practicing Company Secretary, proprietor of M/s Vijay K. Singhal & Associates, New Delhi, has been appointed as scrutinizer for conducting the evoting process in a fair and transparent manner.

The e-voting period commences on Friday, 25th day of September, 2015 (9:00 A.M) and ends on Sunday, 27th day of September, 2015 (5:00 P.M). The remote e-voting module shall be disabled by CDSL, for voting thereafter. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently. The voting rights of members shall be as per the number of equity shares held by the members as on the cut-off date which is Monday, 21st day of September, 2015. A person whose name is recorded in the register of members or beneficial owners as on cut-off date i.e. 21st day of September, 2015, shall be entitled to vote through emote e-voting as well as at AGM. The facility of vote through ballot paper shall be made available at AGM. The members who have cast their vote by remote e-voting prior to the meeting mav also attend the AGM but shall not be entitled to cast their vote again.

Any person, who acquires shares of the Company and becomes member of the Company after the dispatch of Notice of the AGM may obtain the Login id and Password by following the procedure as mentioned in the Notice of AGM or sending a request at helpdesk.evoting@cdslindia.com.

Notice of 66th AGM is also available on Company's website www.jmaindia.com and on CDSL's website www.evotingindia.com.

n case of any query/grievances with regard to e-voting, you may refer the frequently asked questions ("FAQ") and e-voting manual available at www.evotingindia.com/help.jsp or may contact to Mr. Wenceslaus Furtado, Deputy Manager, Central Depository Services (India) Limited; 16th Floor, P. J. Towers, Dalal Street, Fort, Mumbai – 400 001 or write an email to CDSL on helpdesk.evoting@cdslindia.com or contact at help desk 1800-200-55-33.

> For and on behalf of Jullundur Motor Agency (Delhi) Limited Sachin Saluja **Company Secretary**

> > (Membership No.: A24269)



Place: Gurgaon

Date: 03rd September, 2015

1. NOTICE is hereby given that the 40th Annual General Meeting (AGM) of the members of the Company Veejay Lakshmi Engineering Works Limited is scheduled to be held at 10.00AM on Wednesday, the 30th September 2015 at ' Nani Kalai Arangam, Mani Higher Secondary School, Pappanaickenpalayam, Coimbatore - 641037 to transact business as set out in the Notice convening the AGM. Despatch of the Notice of Annual General Meeting along with necessary Explanatory Statement and Annual Report by post / e-mail has been completed on 01-09-2015. Further all of these documents have been posted on the Company's website www.veejaylakshmi.com and on the depository's website www.cdslindia.com. 2. Arrangements have been made with Central Depository Services (India) Limited (CDSL) for remote e-voting on the business to be transacted at the Annual General Meeting. The remote e-voting portel will be open for e-voting by the shareholders from 9.00 AM on 27-09-2015 to 05.00 PM on 29-09-2015. E-voting facility will not be available afterwards. Detailed instructions relating to the procedure for e-voting by the shareholders are available in the Notice to the Annual General Meeting.





Kolkata

SR. NO.	RESOLUTION	NATURE OF RESOLUTION		AGAINST IN (%)
1.	To consider and adopt the audited financial statement for the year ended March 31, 2015 and the reports of the Directors and Auditors thereon.	Ordinary Resolution	99.99%	0.01%
2.	To appoint a Director in place of Shri Mudit Jain, who retires by rotation and being eligible, offers himself for reappointment.	Ordinary Resolution	99.97%	0.03%
3.	To appoint M/s. V. Shankar Aiyar & Co., Chartered Accountants as Auditors and to fix their remuneration in this connection.	Ordinary Resolution	99.99%	0.01%
4.	To approve remuneration payable to Cost Auditors M/s. R. Nanabhoy & Co. and N.D. Birla for the financial year 2015-16.	Ordinary Resolution	93.77%	6.23%
5.	To approve preferential issue of Equity Shares/convertible warrants to the Promoters and business associates.	Special Resolution	99.99%	0.01%
		For	DCW	imited
Date : 2nd September, 2015 Place : Mumbai		Jigna Karnick Dy. Company Secretary		

KERNEX MICROSYSTEMS (INDIA) LTD.

Corporate Identification No. (CIN) - L30007TG1991PLC013211

Regd.off: "THRUSHNA" Plot No.7, Software Units Layout,

Madhapur, Hyd-500081. Ph:+91-40-23113192,

E-mail: kernex@kernexmail.in, Web site: http://www.kernex.in

NOTICE OF 23rd ANNUAL GENERAL MEETING,

BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 23rd Annual General Meeting of the

Company will be held on Monday the 28th September 2015 at 3.00 p.m.

at Hotel Minerva Grand, Sarojinidevi Road, Secunderabad-500003 . The

notice setting out the business to be transacted along with the

explanatory statement pursuant to section 102(1) of the Companies

Act, 2013 and Annual Report(standalone and consolidated) of the

Company for the financial year ended 31st March 2015 have been sent through electronic mode on 03st September'2015 to those shareholders who have registered their e-mail ID'S with the depositories or with the

Company and the physical copies were dispatched to other shareholders

on 03rd September'2015. The Annual Report along with the notice is

available on Company's website www.kernex.in and also on the website

of karvy computer share (p) Itd- evoting.karvy.com and also is available

for inspection by the members at the Company's Registered office on

all working days except on Saturdays, Sundays and public holidays

Notice is further given that pursuant to section 91 of the Companies

Act, 2013 read with Rule 10 of the Companies (Management and

Administration) Rules 2014 and clause 16 of the listing Agreement the

Register of Members and the Share transfer Books of the Company

will remain closed from Monday the 21 st September 2015 to 28th

September 2015 (both days inclusive) for the purpose of AGM.

from 10.00A.M to 5.00P.M up to the date of AGM.

B. BOOK CLOSURE

C. E-VOTING

A. ANNUAL GENERAL MEETING

A person who has acquired shares and become a shareholder of the 4. Company after the dispatch of the AGM Notice and holding shares as of

thereafter

3" September 2015

Ahmedabad

- Cut-off date i.e. 22^{sd} September 2015, may obtain the login ID and password by sending a request at einward.ris@karvy.com. However, if the person is already registered with Karvy for remote e-voting then the existing user ID and password can be used for casting vote.
- The facility for voting by poll shall also be made available at the AGM and the 5. shareholders who have not cast their vote by remote e-voting shall be able to exercise their right to vote at the AGM. The shareholders who have already cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again.
- 6. The AGM Notice containing the procedure for e-voting is also displayed on the website of the Company at www.suzlon.com and on the website of Karvy on https://evoting.karvy.com.
- 7. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for shareholders and e-voting User Manual for shareholders available at the download section of https://evoting.karvy.com. In case of any grievances, you may contact Mr. K.S.Reddy, Asst. General Manager, Karvy, Unit: Suzlon Energy Limited, Karvy Selenium, Tower B, Plot 31 & 32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad-500032 at 040-67162222 or at 1800-3454-001 (toll free); email: einward.ris@karvy.com.
- Mr. Ravi Kapoor, Practicing Company Secretary (Membership No.F2587 8. and Certificate of Practice No.2407) has been appointed as Scrutinizer for conducting the voting process in a fair and transparent manner.

For Suzlon Energy Limited

Sd/-Hemal A.Kanuga, Company Secretary. M. No. F4126.

Note: Those shareholders who have still not registered their email address are requested to register the same at the earliest, in respect of electronic holdings through concerned depository participants and in respect of physical holdings with the Company's Registrar and Share Transfer Agents, Karvy.

TOSCHIP MOSCHIP SEMICONDUCTOR TECHNOLOGY LIMITED Regd. Office: Plot No.83 & 84, 2" Floor, Punnaiah Plaza, Road No.2 Banjara Hills, Hyderabad 500 034. Telangana, India. CIN: L31909TG1999PLC032184 Email: investorrelations@moschip.com; www.moschip.com

NOTICE

NOTICE is hereby given that the 16the Annual General Meeting (AGM) of the Members of MosChip Semiconductor Technology Limited will be held at its registered office Plot No.83 & 84, 2nd Floor, Punnaiah Plaza, Road No.2, Banjara Hills, Hyderabad 500034, Telangana state, India on Wednesday, 30th September 2015 at 10.30 A. M.

The Notice of the Meeting and the Explanatory Statement along with the Audited Standalone and Consolidated Financial Statements, Report of the Board of Directors and the Auditors' Report for the financial year ended 31st March 2015 has been sent electronically to those Members whose email address are registered with the Company/Depository Participant for communication purposes. For Members who have not registered their email address or have requested for hard copies, the Annual Report has been sent at their registered address by courier.

Notice is further given pursuant to section 91 of the companies Act, 2013 and the applicable Rules there under, that the Register of Members and the Share Transfer Books of the company will remain closed from Thursday, 24th September, 2015 to Wednesday, 30" September, 2015 (both days inclusive). Members are hereby informed that in compliance with the provisions of

Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Clause 35B of the Listing Agreement, MosChip Semiconductor Technology Limited (MosChip) is providing to the Members the facility to exercise their right to vote at the 16th AGM by electronic means and the business may be transacted through the e-voting services (remote e-voting) provided by Karvy Computershare Pvt. Ltd.

Persons entitled to attend and vote at the AGM, may vote in person or by proxy Pursuant to section 108 of the Companies Act 2013 read with Rule 20 through authorized representative, provided that all proxies in the prescribed of the Companies (Management and Administration) Rules 2014 the form /authorization duly signed by the person entitled to attend and vote at members are provide with the facility to cast their votes electronically the meeting are deposited at the Registered Office of the company, not later than 48 hours before the AGM.

- User ID and password along with a copy of the Notice convening the meeting has been dispatched to the Members. The Notice of the meeting can also be viewed at www.rajrayon.com.
- The remote e-voting facility shall commence on 26" September, 2015 from 09:00 a.m. and ends on 29" September, 2015 at 05:00 p.m. The remote e-voting shall not be allowed beyond the said date and time. A person, whose name appears in the register of Members as on the cut-off date i.e.23" September, 2015 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the meeting.
- Any person who becomes member of the Company after dispatch of the Notice of the meeting and holding shares as on the cut-off date i.e. 23" September, 2015, may obtain the User ID and Password by sending a request at rnt.helpdesk@linkintime.co.in. If the member is already registered with CDSL for e-voting then he can use his existing User ID and Password for casting the vote through remote e-voting. The members who have cast their vote by remote e-voting may
- attend the meeting but shall not be entitled to cast their vote again. The Company shall be making arrangements for the members to
- cast their votes in respect to the business either through electronic voting system or through poll/ballot for members attending th meeting who have not cast their vote by remote e-voting.
- Any query/grievance connected with the voting by electronic means may be addressed to:
 - Name: Mr. Wenceslaus Furtado, Designation: Deputy Manager Central Depository Services India Limited, Address: Phiroze Jeejeebhoy Towers, 16" Floor, Dalal Street, Fort, Mumbai - 400001, email id helpdesk.evoting@cdslindia.com, Phone number: 18002005533.

By order of the Board For Raj Rayon Industries Limited Sd/-

Place: Mumbai Gita Yadav Dated: 03rdSeptember, 2015 Company Secretary & Compliance Officer

KASHIRAM JAIN AND COMPANY LTD.

CIN: L51909AS1987PLC002828

Regd. Office: Lachit Nagar, S. R. B. Road, Guwahati - 781007, Assam Tel No.: 08443888402, E-mail: kjcl002828@yahoo.co.in, Website: www.kashiram.co

NOTICE OF 28TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

(A) Annual General Meeting:

NOTICE is hereby given that the 28th Annual General Meeting (AGM) of the Members of the Company is scheduled to be held on Monday, September 28, 2015 at 11.00 a.m. to transact the business set out in the notice of the 28th AGM at Lachit Nagar. S. R. B. Road, Guwahati - 781007, Assam.

The Company has completed the dispatch of the Annual Report containing Notice of the AGM along with the Audited Financial Statements (both Standalone and Consolidated) and the reports of the Auditors' and Directors', to the members of the Company individually at their Registered Addresses. The aforesaid documents have been sent electronically to those Shareholders who have registered their e-mail addresses

Shareholder are hereby informed that the Notice of the Meeting and aforesaid documents are available on the Company's Website http://www.kashiram.co and also available for inspection at the Registered Office of the Company between 11.00 a.m. to 1.00 p.m. on any working day excluding Saturday and Sunday prior to the date of the AGM.

(B) Book Closure:

Notice is further given pursuant to section 91 of the Companies Act, 2013 read with Rule 10 of Companies (Management and Administration) Rules, 2014 and Clause 16 of the Listing Agreement, the Register of Members and Share Transfer Book of the Company will remain closed from September 21, 2015 (Monday) to September 28 2015 (Monday) (both days inclusive) for the purpose of AGM.

(C) E-Voting:

In Compliance with the provisions of section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administrations) Amendment Rules, 2015 and Clause 35B of the Listing Agreement, the Company is pleased to provide its Member facility to cast their vote electronically from a place other than the venue of the AGM (remote e-voting) on all resolutions set forth in the Notice, for which the Compan has engaged the services of the Central Depository Services (India) Limited (CDSL as e-voting agency

The remote e-voting facility shall commences on Friday, 25th September, 2015 (9.00 a.m.) and end on Sunday, 27th September, 2015 (5.00 p.m.). During this period Shareholders' of the Company may cast their vote electronically on the item: mentioned in the Notice of AGM. The e-voting module shall be disable for voting thereafter. Once the vote on a Resolution is cast by the Shareholder, the Shareholder shall not be allowed to change it subsequently. A person whose name appears on the Register of Members/Beneficial Owners as on the cut off i.e. date 21st September, 2015 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the Meeting. Any person who becomes Member of the Company after dispatch of the Notice and holding shares as on cutoff date may obtain the User Id and Passwords by sending a request at helpdesk.evoting@cdslindia.com. In terms of Clause 35B of the Listing Agreement with the Stock Exchanges, the Company, in order to enable its Members who do not have access to e-voting facility, has enclosed a Ballot Form along with the Annual Report to convey their assent or dissent in writing in respect of the resolutions as set out in the Notice together with the postage prepaid self-addressed business reply envelope so as to reach the Scrutinizer on or before Sunday, 27th September, 2015 before the closure of business hours of the Company i.e. 6.00 p.m. The Members, who have not cast their vote either through remote e-voting or through Ballot Form, can exercise their voting rights at the AGM. The Company will make necessary arrangement in this regard at the AGM Venue and shall be able to vote at the Meeting through polling paper. Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM, however those Members shall not be entitled to cast their vote again at the AGM. The communication relating to remote e-voting, inter-alia, containing User Id and Password along with the copy of the Notice convening the Meeting has been dispatched to the Members. This communication and Notice of the Meeting are available on the website of the Company http://www.kashiram.co and on the website of CDSL at URL: https://www.cdslindia.com. The detailed procedure for obtaining User Id and Password are also provided in the Notice of the Meeting which is available at Company's website and CDSL's website. I the Member is already registered with CDSL for e-voting then he can use the existing User Id and Password for casting the vote through e-voting. In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com. The result of e-voting shall be announced on or after the AGM of the Company. The results declared alongwith Scrutinizer's Report shall be placed on the Company's website http://www.kashiram.co/ and on the website of CDSL https://www.cdslindia.com for information of the members, being communicated to the Stock Exchanges. A MEMBER ENTITLED TO ATTEND AND VOTE AT THE MEETING IS ENTITLED TO APPOINT A PROXY/ PROXIES TO ATTEND AND VOTE INSTEAD OF HIMSELF/HERSELF AND PROXY/ PROXIES NEED NOT BE A MEMBER OF THE COMPANY. The Instrument appointing the Proxy / Proxies, in order to be valid and effective, should be deposited at the Registered Office of the Company not less than 48 hours before the commencement of the AGM. By Order of the Board of Director For Kashiram Jain & Co. Ltd. Shweta Harlalka Place : Guwahati

3. Arrangement will be made for voting by ballot paper at the Annual General Meeting by the shareholders / proxies. Those shareholders who have voted already by remote e-voting can attend the Meeting but will not be permitted to vote by ballot at the meeting.

4. The shareholders who are entitled to vote at the Meeting will be determined on 23-09-2015 Only those shareholders who are holding shares at the close of working hours on 23-09-2015 will be eligible to vote either by remote e-voting or voting by ballot at the Annual General Meeting.

Any one who has acquired shares after despatch of Annual Reports and became a shareholder on the record date ie., on 23-09-2015, can obtain the ID and PASSWORD by sending a e-mail request to helpdesk.evoting@cdslindia.com or to info@skdc-consultants.com.

If the members have any other questions or need any clarification they may contact by e-mail at info@skdc-consultants.com or over phone at 0422-6549995 or by post / in person at S K D C Consultants Limited, Kanapathy Towers, 3rd Floor, 1391/A-1, Sathy Road, Ganapathy, Coimbatore-641006.

Notice is further given pursuant to Section 91 of the Companies Act, 2013 and CI.16 of the Listing Agreement that the Share Transfer Books of the Company will remain closed from Thursday, 24-09-2015 to Wednesday, 30-09-2015 (both days inclusive) for the purpose of the Annual General Meeting.

By order of the Board For Veejay Lakshmi Engineering Works Limited Date : 03.09.2015 V.J. Jayaraman Chairman and Managing Director Place : Coimbatore



SEL Manufacturing Company Limited (CIN: L51909PB2000PLC023679)

Regd. Office : 274, Dhandari Khurd, G.T. Road, Ludhiana (Punjab) 141014

Ph.: +91-161-6611111, Fax : +91-161-6611112, Website: www.selindia.in NOTICE

Notice is hereby given that the 15th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Wednesday, the 30th day of September, 2015 at 9.30 A.M. at the Registered office of the Company situated at 274, Dhandari Khurd, G.T. Road, Ludhiana (Punjab) 141014 to transact the business(es) as specified in the Notice thereto.

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, alongwith Clause 35B of the Listing Agreement, the company is providing its members facility to exercise their right to vote on the resolutions proposed to be passed in the 15th Annual General Meeting of the Company using electronic voting system from a place other than the venue of the meeting ("remote e-voting"). The Company has engaged the e-voting facility organized by Central Depository Services (India) Limited, (CDSL).

You may please note that the remote e-voting will start on September 27, 2015 at 09.00 a.m. and ends on September 29, 2015 at 05.00 p.m.. The remote e-voting shall not be allowed beyond the said date and time and the e-voting module shall be disabled thereafter. Members of the Company holding shares in either physical or in dematerialized form as on 23rd September, 2015, being the cut-off date, may cast

Phone: +91-040-66229292, Fax: +91-040-66229393

rom a place other than the venue of AGM on all resolutions set out in the Notice and the Company has engaged the services of Karvy Computershare Private Limited as e-voting agency.

The cut off date to determine eligibility to cast votes by electronic voting is Monday the 21st September 2015. The remote e-voting commences on Monday the 21st September 2015 at 09.00 A.M and ends on Sunday the 27th September 2015 at 5.00p.m. The e-voting modue shall be disabled for voting thereafter and the remote e-voting shall not be allowed beyond the date and time.

In case a person has become a member of the Company after dispatch of the AGM notice but on or before the cut off date for e-voting ie 21st September 2015 he may write to Karvy on the e-mail ID at evoting @ karvy.com requesting for the used ID and password. If the member is already registered with Karvy for evoting the member can use the existing user Id and password for casting the vote through remote evoting. Karvy shall also will send user id and password to the new members whose e-mail ID's are available.

The members who have not cast their vote through remote e-voting can exercise their voting rights at the AGM. The Company will make arrangements of ballot papers at the venue of AGM. Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled for voting again A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut off date only shall be entitled for remote e-voting as well as voting at the meeting through ballot papers. In case of any grievance in respect of e-voting members may refer to

the help and FAQ and e-voting user manual available at the download section of evoting.karvy.com or contact Mr. K. S. Reddy, Asst. General Manager (Unit: Kernex Microsystems (India) Limited at Karvy Selenium Tower B, Plot 31,32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad-500032 or at evoting@karvy.com or phone no 040 67161500 or karvy toll free no 18003454001

The result of e-voting shall be announced on after the date of AGM and the result declared along with the scrutinizer report shall be placed on the Company's website www.kernex.in and on the website of http//evoting.karvy.com for the information of members and also communicated to the stock exchanges

For KER	r KERNEX MICROSYSTEMS (INDIA) LIMITED	
	Sd/-	
Place : Hyderabad	COL. L.V. RAJU (RETD.)	
Date : 04-09-2015	Managing Director	

The instructions for e-voting are given in the Notice of the AGM. Members are requested to note the following:

1. The remote e-voting facility will commence on 27th September, 2015 at 9.00 am and will end on 29th September, 2015 at 5.00 pm. The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the e-voting module shall be disabled by Karvy upon expiry of afore said period.

2. The voting rights of the shareholders)for voting through remote e-voting or by Poll Paper at the Meeting(shall be proportion to their share of the paid-up equity share capital of the Company as on 23rd September 2015)'Cut-Off Date"(A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, as well as voting at the AGM.

3. Any person who becomes a member of the Company after dispatch of the Notice of the Meeting and holding shares as on the cut-off date i.e. 23rd September, 2015, may obtain the User ID and password by sending a request at evoting@karvy.com or may contact on toll free number provided by Karvy: 1-800-3454-001

4.Facility of voting through Poll paper shall also be made available at the Meeting. Members attending the Meeting, who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right at the Meeting.

5.Members who have cast their vote by remote e-voting prior to the Meeting may also attend the Meeting, but shall not be entitled to vote again at the AGM. A Copy of the AGM Notice is available on the website of the Company at www.moschip.com.

The Company has appointed Mr. CS Puttaparthi Jaganatham, advocate as Scrutinizer for conducting the remote e-voting and Insta Poll process for the Annual General Meeting in a fair and transparent manner.

The results of the remote e-voting and votes cast at the AGM shall be declared not later than three days from the conclusion of the Meeting. The Results declared, along with the Scrutinizer report, shall be communicated to the stock exchange where the company is listed, Viz BSE Ltd. If the Member wishes to get a printed copy of the Annual Report, the Company will send the same, free of cost, upon receipt of request from the Member.

Any query or grievance connected with remote e-voting or voting through Ballot Paper may be addressed to Mr. CS Suresh Bachalakura, Company Secretary of the Company, at Plot No.83 & 84, 2nd Floor, Punnaiah Plaza, Road No.2, Banjara Hills, Hyderabad 500 034. Tel No.040-6622-9292. Fax 040-6622-9393 Email:suresh.cs@moschip.com

BY ORDER OF THE BOARD OF DIRECTORS Hyderabad CS Suresh Bachalakura 04/09/2015 Company Secretary NOTE: A MEMBER ENTITLED TO ATTEND AND VOTE AT THE ANNUAL GENERAL

MEETING IS ENTITLED TO APPOINT A PROXY TO ATTEND AND VOTE INSTEAD OF HIM AND THE PROXY NEED NOT BE A MEMBER OF THE COMPANY.

their vote electronically on the Ordinary and Special Business(es)as mentioned in the Notice of 15th AGM.

A person whose name appears in the register of Members/Beneficial owners as on the cut-off date i.e. 23.09.2015 only shall be entitled to avail the facility of remote evoting/voting in the Annual General Meeting.

Any person who becomes a member of the Company after dispatch of the Notice of the meeting and holding shares as of the cut off-date i.e. 23.09.2015, may obtain the User ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. The detailed procedure for obtaining User ID and password is also provided in the Notice of the meeting which is available on company's website and CDSL website i.e. www.cdslindia.com. If the member is already registered with CDSL e-voting then he/she can use his/her existing user ID and password for casting the vote through remote e-voting.

The members who have cast their vote by remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again in the meeting. Members, who have not voted through remote e-voting and present at the AGM in person or proxy, can vote through the ballot/polling paper, at the AGM. For any queries or issues regarding e-voting please refer to e-voting instructions mentioned in the Notice of the AGM or visit website of Central Depository Services (India) Limited, (CDSL) at www.evotingindia.com. In case of any queries/grievances, members may refer to the Frequently Asked Questions ("FAQs") for Members and e-voting User Manual available at www.evotingindia.com or contact e-voting helpdesk at the designated email id i.e. helpdesk.evoting@cdslindia.com or can also refer to Mr. Swapan, Asst. Vice President, Link Intime India Pvt. Ltd., 44, Community Centre, 2nd Floor, Naraina Industrial Area, Phase -I, PVR Naraina, New Delhi 110 028 Ph. No: 011-41410592, E-mail delhi@linkintime.co.in

Further pursuant to Section 91 and other applicable provisions of the Companies Act, 2013 & clause 16 of the Listing Agreement with the Stock Exchanges, notice is hereby given that the Register of Members & Share Transfer Books of the Company will remain closed from September 24, 2015 to September 30, 2015 (both days inclusive) for the purpose of 15th Annual General Meeting (AGM) of the Company. Members who have not registered their e-mail IDs so far, are requested to register their e-mail IDs, with their concerned Depository Participants in respect of electronic holdings and members who hold shares in physical form with M/s Link Intime India Pvt. Ltd., Registrar and Share Transfer Agent

For SEL Manufacturing Company Ltd.,

Sd/ RAHUL KAPOOR COMPANY SECRETARY







Date : 03.09..2015



Date: 03.09.2015

Place: Ludhiana

Company Secretary

31

S

18

12

સુઝલોન એનર્જી લીમીટેડ

[સીઆઈએનએલસ્ટ૧૦૦ક્ષ્પે૧૯૯૫પીએલસી૦૧૫૪૧૭] રાક્ષ્ટરંડે ઓઇંસઃ "સુઝશોન", ૫ ગ્રીમાળી સોસાપક્ષ, ગ્રી કિમ્પ કોમ્પલેશની બાજુમાં નવરંગપુરા, અમગ્રવાક-૩૮૦૦૦૯ ટેલીઃ ન૯૧-૭૯-૬૬૦૪૧૦૦૦, ફેક્સ ન૯૧-૭૯-૨૬૫૯૫૫૪૦, વેબસાઈર :www.sudon.com ઈ-મેઈલ આઈડીઃinvestors@sudon.com

વીસમી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ, બુક ક્લોઝર અને ઈ-વોટીંગની માહીતી

આધી. તોરીસ આપેલ છે કે. તારીખ ૩૧ જુવાઈ ૨૦૧૫ ના રોજની એ કર એમ.ની તોરીસ માં ("એ કર એમ. નોરીસ") નક્ક્સી કર્યા મુજબ વેપરમાં વ્યવસારો માટે સુઝલોન એનાઈ લીમીટેડ ("ઇપની") ની વીસમી ધાર્પિક સાયાન્ય સભા ("એ કર એમ ") સોમવાર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યે જે.બી. ઓડીટોરીયમ એ એમ એ સેમયેલ, અરીસ. હી. વિસમ સારાજ્ય મારે ૨૦૧૫ ૧૧.૦૦ વાગ્યે જે.બી. ઓડીટોરીયમ એ એમ એ સેમયેલ, અરીસ. હી. વિસમ સારાજ્ય ૨૦૧૫ ૧૧.૦૦ વાગ્યે જે.બી. ઓડીટોરીયમ એ એમ એ સેમયેલ, અરીસ. હી. વિસમ સારાજ્ય ૨૦૧૫ ૧૧.૨૦૦ વાગ્યે જે.બી. ઓડીટોરીયમ એ એમ એ સેમયેલ, અરીસ. હી. વિસમ સારાજ્ય ૨૦૧૫ ૧૧.૨૪ પુરા થતા વર્ષ માટે ઓડીટ કરેલ વાલાંકીય હિસાઓનો સમાવેશ કરતાં વાર્પિક અહેવાલ અને હિસાબનીશોનો અને ડાયરેક્ટરો (તેના અનેશવે સાથે) ના અહેવાલો અને હાજરીની સ્લીપ સાથે કેસ અનેમ. નોટીસની બીટીસ નકલો શેર ધારકોને રચાયા કરવાનું ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ પૂછ કરેલ છે. જેઓએ તેમના ઈ-મંદલ એટ્રેસ નોટાલેલ વર્ષી અને શેર ધારકો જેઓએ તેમના ઈ મંદલ એટ્રેસ્ટ મોરેલ છે તેઓને ઇલેકટ્રોનીક કરી મોકલેલ છે. મહેરબાની કરીને બાને લેશો કે. કંપનીના મુલ્યતન સભા તરીકે. વાં પેલે વિત્રાનો છે તેથેલ પાલે માટે આજાબાદેખાના પ્લાક્સ સાથા તે છે. છે અને કંપનીની રાજરુર સ્થાય વિરાદ્યો વિત્ર બીડી અપરાય માટે પ્લાક્ષ માકારા માટે હડલાર છે અને કંપનીની રાજરુરી અપેલ કરતાવેથે કંપનીની વેસ્સાઈટ www.sudon.com ઉપર ઉપલબ્ધ છે અને કંપનીની રાજરુરી રાજ્યન દિવસો સિવાય) બધોરના ૨.૦૦ વાચ્યા થી ૫.૦૦ વાચ્યા સુધી એ કલ એમ ની તારીજ સુધી ઉપલબ્ધ છે.

હાજરી આપવા અને મત આપવા હક્કલર રાભ્ય, તેના પોતાના બારવે મત આપવા અને હાજરી આપવા પ્રતિનિધિની નિમભ્નુંક કરવા હક્કલર છે અને પ્રતિનિધિ કંપનીનો સભ્ય હોવો તે જરૂરી નથી. પ્રતિવિધિ નિયુક્ત કરતો પત્ર (સૂચવેલ શેર્મમાં), અસરકારક થવા માટે, એ જી એમ. આરંભ થતા અગાઉ ઓછા મા ઓછા ૪૮ (અડતાથીસ) કલાક કરતાં પહેલા કંપનીની રજીસ્ટર્ડ ઓલીસ ખાતે જમા કરાવવા આવશ્યક છે.

કંપનીઓના અધિનિયમ, ૨૦૧.૭ની કલમ-૯૧ અને તેમા હેઠળ બનેલા નિયમોને સાથે વાંચતા સ્ટોક અલચે-જો સાથે લીસ્ટીંગ એગ્રીમેન્ટના નિયમ-૧૬ ને અનુસરતા, આથી નોટીસ આપેલ છે કે, સૂઝલોન એનજીલીમીટેડના સભ્યો ના રજીસ્ટર અને શેરટ્રાન્સકર બુક એ જી એમ. હેતુ માટે લુધવાર, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫થી સોમવાર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ (બર્થેલિવ્યો સહીત) બંધ રહેશ.

કંપનીઓના અધિનિષમ, ૨૦૧ કની કલય-૧૦૮ ની સાથે વાંચતા તેનાં હેઠળ બનેલા નિયમી અને સ્ટોક એક્ષચેન્જો સાથે લીસ્ટીંગ એગ્રીમેન્ટમાં નિષમ-૩પ-બી ની પૂર્તતામાં, કંપનીએ કંપનીના શેર ધારકોને એ જી એમ. સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપરથી ઈલેક્ટ્રોનીક મત ("રીમોટ ઈ-વોટીંગ") પહાંતેની સગવડ પૂરી પાડવા માટે કાર્વી કોમ્પ્યુટર પ્રાઈવેટ લીમીટેડ ("કાર્વી")ની સેવાઓ ઉપલબ્ધ કરાવેલ છે. સીમોટ ઈ-વોટીંગના સંક્રભમાં શેરધારકોનો નીચેની માલીતી પુરી પાડવામાં આવી રહી છે:

- શેરધારકો રીમોટ ઈ-વોટીંગનો ઉપયોગ કરી એ. છ. એમ. નોટીસમાં નક્કી કરેલ તમામ ઠસવો ઉપર તેઓનો મત આપી શકે,
- ર. શેરધારકોધાભ મેળવનાર માલીકોના ઈ-વોર્ટીંગ હક્સે, કટ-ઓઇ તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ મુજબ ધારક્ષ કરેલ ઈક્વીટી શેરો ઉપર થી નક્સે કરવામાં આવશે. વિભીતિકોકરણ થયેલ કે ભૌતિક સ્વરૂપમાં કટ-ઓફ તારીખે શેર ધરાવતા કંપનીના શેરધારકો, માત્ર સીમેટ ઈ-વોર્ટીંગ તેમજ એ.જી. એમ. માં મત આપવાની સગવડ માટે હક્કલર રહેશે.
- 3. ઈન્વોરીંગનો સમયગાવો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ સવારના ૯૦૦વાએ આર્ટલ થશે અને ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યે પુરો થશે. તે પછી, મતલનની મંજુરી આપવામાં આવશે નહીં અને ઈન્વોરીંગમો ડ્યુલ ત્યારબાદ મતાદ્રન માટે કાર્વી લરા સ્થગિત કરવામાં આવશે.
- ૪. એ. છા, એમ. નોટીસ મોકલ્પા પાછી અને કટ-ઓફ તાડીખ એટલે કે ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ મુજ્ય જે વ્યક્તિ એ શેર પ્રાપ્ત કરેલ છે અને કંપનીનો શેરધારક બનેલ છે, તે einward.ris@karvy.com ઉપર વિનંતી મોકલી લોગીન આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત કરી શકે, તેમ છતાં. જો વ્યક્તિ પહેલેથી જ ટીમોટ ઈ-વોટીંગ માટે કાવી સાથે નોંધાયેલ છે તો મત આપવા માટે અસ્તિત્વમાં હોય તે પુઝર આઈડી અને પાસવર્ડ વાપરી શકાય.
- પ. મતની સંખ્યા દ્વારા મતલન માટેની સગવડ એ.જી.એમ. ખાતે પાસ ઉપલબ્ધ કરાવાશે અને શેરધારકો કે જેઓએ તેમનો મત રીમોટ ઈ-વોટીંગ દ્વારા આપેલ નથી. તેઓ એ.જી.એમ. ખાતે તેમનો મત આપવાના હાક્કનો ઉપયોગ કરવા સમર્થ રહેશે. જે શેરધારકોએ એ.જી. એપ. પહેલા રીમોટ ઈ-વોટીંગ દ્વારા મત આપેલ છે તેઓ એ.જી.એમ. મા હાજરી પાસ આપી શકે, પરંતુ, તેમનો મત કરીથી આપવા હક્કલર રહેશે નહી.
- ઈ-વોર્ટીંગ માટે કાર્યવાહીનો સમાવેશ કરતી એ જી એમ.ની નોટીસ કાર્વીની વેબસાઈટ https://evoting.karvy.com અને કંપનીની વેબસાઈટ www.suzton.com ઉપર પ્રદર્શિત પક્ષ કરેલાછે.
- હ. કોઈપ્લાય આ હોય તેવા કિસ્સામાં, https://evoting.karvy.com ના હાઉનલો ડ વિભાગ ઉપર ઉપવબ્ધ શેરધારકો માટેના ઈન્ટોર્ટીંગ યુઝર મેન્યુઅલ અને શેરધારકો માટે ક્રિકવચ્ચ્લી આસ્કડ કવેશચ્યન (એક.એ.ક્યુ) ને જોઈ પણ શકો છો. કોઈપલ કવીમાંક હોય તેવા કિસ્સામાં, આપ શ્રી કે. એસ. ટેકી, આસી, જનરલ મેનેજર, કાર્વી ક્રોમ્યુટરશેર પ્રાઈવેટ લીમીટેડ, વુનિર સુઝલોન એનસર્બ લીમીટેડ, કાર્વી સેલેનીયમ, ટવર-બી, પ્લોટ ૩૧ અને ૩૨, ગાચીબાવલી, ક્રાયના સ્વીયલ ઉપરીક્ષ નાનકમગુપ, હોહ્યબાહ-પ૦૦૦૩૨ નો ૦૪૦-૬૭૧ ૬૨૨૨૨ ઉપર અથવા ૧૮૦૦-૩૪૫૪-૦૦૨ (ટોલ ક્રી) ઉપર, ઈ-મેઈલ:einward.ris@karvy.com ઉપર સંપર્કરો.
- ૮. કંપની સેકેટરી તરીકે કાર્યરેલ શ્રી રહી કપુર સિબ્ધપદ ને એક્ટપટ અને પ્રેક્ટ્રીસનું પ્રયાલપત્ર ને ૨૪૦૭) ની વ્યાજબી અને પારસ્થી રીતે મતલન સંચાલન કરવા માટે ઝીસપટથી તપાસકરપર તરીકેનિમસુંક કરવામાં આવેલ છે.

સુઝલોન એનસર્ક લીમીટેડ વતી. સંઘી હેમલ એ. કાનુગા, કંપની સેઠેટરી. એમ. ને એક૪૧૨૬,

3 સપ્ટેમબર ૨૦૧૫ અમદાવાદ

114:-

શેર ધારકો જેઓએ હજી સુધી કંપનીના રજીમ્સર અને શેર ટ્રાન્સકર એજન્ટ કાર્વી સાથે ભૌતિક ખાતાઓના સંદર્ભમાં અને વાગતા વળવતા થાપક્ષ રાખનાર સહભાગીઓ મારકતે ઈલેક્ટ્રોનીક ખાતાઓના સંદર્ભમાં જેઓએ હજી સુધી તેઓના ઈન્સેલ એડેસ નોંધાવેલા નથી તેમને જલ્લીથી તે નોંધાવવા અથવા તેની નોંધક્ષી કરાવવા વિનેની છે.